

01 માર્ચ 2019

## બ્રમ્પટનના સાહસિક મેળવે છે ડ્રેગન્સ ડેન (Dragons' Den)માં સિદ્ધિ

**ફેશન બ્રાન્ડ "લવ એન્ડ ન્યુડ્સ (Love & Nudes)" નાં સહ-સ્થાપકો મેળવે છે સીડ-ફંડિંગ તરીકે \$40 હજાર.**

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 માર્ચ 2019) – ગઈકાલે સીબીસીના ડ્રેગન્સ ડેન (Dragons' Den) સમક્ષ સફળ રજૂઆત કર્યા બાદ શાંતલ કાર્ટર ટેલર (Chantal Carter Taylor) અને કોલિન કોલ (Colleen Cole)એ – પોતાની કંપનીમાં 40 ટકા હિસ્સાનો વિનિયોગ કરીને \$40,000 સીડ ફંડ તરીકે મેળવ્યાં – જેઓ ફેશન બ્રાન્ડ લવ એન્ડ ન્યુડ્સ (Love & Nudes) નાં સહ-સ્થાપકો છે.

ટેલર, જેમણે સૌપ્રથમ બ્રમ્પટન આંતરપ્રુન્યોર સેન્ટર (BEC)ને પોતાના બિઝનેસ મોડેલના વિકાસાર્થે 2016માં સહાયતા માટે વિનંતી કરી હતી તેઓ 28 ફેબ્રુઆરી 2019ના રોજ ગુરુવારના દિને આખા કેનેડામાં પ્રસારિત રિયાલિટી શોમાં ઝળક્યા હતાં.

વેન્યર કેપિટલિસ્ટ્સ (દ "ડ્રેગન્સ (Dragons)")ની પેનલ સામે આ જોડીએ 2017માં લવ એન્ડ ન્યુડ્સ શા કારણે ઊભી કરી તેના કારણો દર્શાવીને પોતાનો ધંધો આગળના તબક્કે લઈ જવાની તેમની યોજનાઓ વિશેની વાતો કરી.

તેઓની દોસ દલીલો અને મજબૂત ધંધાકીય મોડેલ અને દરખાસ્ત ડ્રેગન્સ (Dragons) માટે ધ્યાનાકર્ષક પુરવાર થઈ. લવ એન્ડ ન્યુડ્સ (Love & Nudes) શ્યામ ત્વચાધારી મહિલાઓની આંતરવસ્ત્રોના વિકલ્પોની માંગને પહોંચી વળવાનું કામ કરે છે – જેમની દુનિયામાં લગભગ બે તૃતિયાંશ જેટલી વસ્તી છે - એવા વિકલ્પો જે અગાઉ લગભગ અસ્તિત્વમાં જ ન હતાં.

તેઓએ પોતાની કંપનીનાં તે સિદ્ધાંતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે અશ્વેત મહિલાઓનું સશક્તિકરણ કરવું. લવ એન્ડ ન્યુડ્સ (Love & Nudes)નાં તમામ કપડાં મહિલાઓની માલિકી ધરાવતા, વાજબી વેતન પૂરું પાડતા કારખાનામાં બને છે જેમાં કોલમ્બિયાની એકલી રહેતી માતાઓને રોજગાર સાંપડે છે.

ક્લાયન્ટ સ્પોટલાઈટ (Client Spotlight), BECની ઓનલાઈન ચેનલ જે સ્થાનિક સાહસિકોની સફળતાની વાતો ઉજાગર કરે છે તેની સાથે અગાઉ વાત કરતી વખતે ટેલરે જણાવ્યું કે: "BEC'ના સલાહકારોએ મને મારા ધંધાને રજિસ્ટર કરવામાં, મારો માર્કેટિંગ વ્યૂહ તૈયાર કરવામાં, અને યોગ્ય લોકો અને સંગઠનો સાથે જોડાણો સ્થાપવામાં પુષ્કળ માર્ગદર્શન આપ્યું હતું. BECનાં ઈવેન્ટ્સ શીખવા અને કનેક્ટ થવા માટેની સરસ રીત છે – મે વક્તાઓ પાસેથી કેટલીક જોરદાર સલાહ મેળવી છે અને મારા જેવા બીજા સાહસિકો અને તેઓની ધંધા અંગેની કથનીઓથી પ્રેરિત થઈ છું."

BEC આખું વર્ષ વ્યાપાર અને ઓન્ટ્રપ્રનરો એટલેકે સાહસિકોને મદદ કરતા ઈવેન્ટ્સ હાથ ધરે છે. તે વ્યક્તિગત પરામર્શ અને સલાહ પણ આપે છે અને ભંડોળ અને સ્ટાર્ટ-અપ તેમજ પ્રસ્થાપિત વ્યાપારોમાં મદદરૂપ થવાના કાર્યક્રમો સુધી પહોંચવાનું કેન્દ્રબિંદુ છે. વધુ માહિતી માટે [www.brampton.ca/bec](http://www.brampton.ca/bec)ની મુલાકાત લો.

ક્વોટ

“શાંતલ કાર્ટર ટેલર (Chantal Carter Taylor) અને કોલિન કોલ (Colleen Cole)ને ડ્રેગન્સ ડેન (Dragons’ Den) સમક્ષ સફળતાપૂર્વક પોતાની દરખાસ્ત રજૂ કરવા બદલ અભિનંદન. લવ એન્ડ ન્યુડ્સ (Love & Nudes) હવે વૃદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ સારી સ્થિતિમાં છે. આ પ્રકારની ઉત્તમ સાહસિક વૃત્તિ જ બ્રેમ્પટન ખાતે નવા રોજગારની વૃદ્ધિને બળ આપશે – અને આપણી પાસે પ્રતિભાઓનો પાકો પાયો છે. એવા કેટલાયે બ્રેમ્પટનના સાહસિકો છે જેઓ પોતાના ધંધાની કલ્પનાને સાકાર કરવા ડ્રેગન્સ ડેન જેવી વાર્તાની જેમ સંસાધનોની તલાશમાં છે અને તેમને બ્રેમ્પટ આન્ડ્રાપ્યુનર સેંટર ખાતે મદદ મળી રહી છે.

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)